

**PART PLAN SHOWING**

**BLOCK NO :- 588**

**VILLAGE:- GHUMA**

**TALUKA:- DASKROI**

**DISTRICT:- AHMEDABAD**




1 cm = 80.00 mt

**LEGEND**

-  Residential Affordable Housing Zone 1-RAH 1
-  Existing Road
-  Proposed Road
-  TPS Boundary
-  Waterbody

**Part Plan of Sanctioned Development plan (Second Revised) of AUDA Under Govt. Notification no . GH/V/207 of 2014/DVP-112013-4777-L Dated-20/12/2014 U/S -17(1)(c) of the G.T.P.& U.D. Act-1976**



This part plan is certified for the BLOCK NO :- 588

**NOTE :-** This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as Development Permission or Permission for Addition/Alteration.

Prep. By: 

Chd. By: 

J. D' man: 

Date: 14-10-2020

Receipt No: 3920

TRUE COPY



Assistant Town Planner  
Ahmedabad Urban Development Authority  
Ahmedabad.

**PART PLAN OF  
DRAFT TOWN PLANNING SCHEME NO.3 (GHUMA)**

**FINAL PLOT NO: 64**


**ORIGINAL PLOT NO: -**



**SCALE:1C.M.=20.0M.**

**LEGEND**

- O.P BOUNDARY  
 F.P BOUNDARY



**This part plan is certified for the F.P NO: 64**

SANCTIONED UNDER GOVT. NOTIFICATION NO:  
GH/V/24 of 2016/TPS-112011-3314-L. DATE: 04/02/2016.

**NOTE:-**

This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration.

**TRUE COPY**

Prep. By

Chd. By:

For D' man:

Assistant Town Planner  
Ahmedabad Urban Development Authority  
Ahmedabad.



# અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪.  
ફોન નં.: ૨૭૫૪૫૦૫૧, ૨૭૫૪૫૦૫૨, ૨૭૫૪૫૦૫૪



ઑડાની વેબ સાઈટ : [www.auda.org.in](http://www.auda.org.in)

- ઑડાની વિકાસ યોજના.
- માળખાકીય સુવિધાઓ. (INFRASTRUCTURE)
- સામાજિક સેવાઓની યોજનાઓ.

હવે વિવિધ માહિતી ઉપલબ્ધ છે, - જેવી કે...

- નગર રચના યોજનાઓ. (ટી.પી.સ્કીમ)
- પર્યાવરણલક્ષી યોજનાઓ
- અન્ય પ્રોજેક્ટ

અરજી નંબર \_\_\_\_\_

પહોંચ નંબર ૩૮૮૨૦

પ્રતિ શ્રી, ડિજિટલ સર્કલ

**ઝોનીંગ સર્ટીફિકેટ**

તા.: ૧૩-૧૦-૨૦૨૦

વિષય : વિકાસ યોજના ૨૦૨૧ ના ઝોનીંગ સર્ટીફિકેટ અંગે.

સંદર્ભ : આપશ્રીની તા ૧૩-૧૦-૨૦૨૦ની અરજી અન્વયે

ઉપરોક્ત વિષયે મોજે દુબા તાલુકો દસક્રીદી બ્લોક નં./સર્વે નં. ૫૮૮

ની જમીન

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ ૧૭ (૧) (ક) હેઠળ તા. ૨૦-૧૨-૨૦૧૪ના રોજ રાજ્ય સરકાર શ્રી એ મંજૂર કરેલ દ્વિતીય પુનરાવર્તીત વિકાસ નકશાની દરખાસ્ત મુજબ સદરહુ જમીનમાંથી \_\_\_\_\_

ના રોડની કપાત્ર થાય છે. બાકીનો ભાગ \_\_\_\_\_

દસક્રીદી બ્લોક ડેવલપમેન્ટ ઓથોરિટી લિમિટેડ કોન-૧-૨૫૫

ઝોનમાં આવે છે.

૧. સદરહુ જમીન દુબા ટી.પી. સ્કીમ નં ૩ (ફાહટ અંજુર)

તથા \_\_\_\_\_ ના વિસ્તારમાં આવતી હોવાથી

તેને ટી.પી. સ્કીમ હેઠળ અન્ય દરખાસ્તો - જોગવાઈઓ ફેરફાર ને બંધનકર્તા રહેશે.

૨. દ્વિતીય પુનરાવર્તીત વિકાસ યોજનાની દરખાસ્તો સરકાર શ્રી ને આધીન ફેરફારને પાત્ર રહેશે.

નોંધ : “આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે  
બાંધકામની પરવાનગી નથી”

CHD BY: [Signature]  
CHD MAN: [Signature]



[Signature]  
મદદનીશ નગર નિયોજક  
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ  
અમદાવાદ